

જાન્યુઆરી 11, 2018

## અસ્ક્યામત સંચાલન માટેની વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત લાયકાતો (ગ્લોબલી રેકોનાઈઝ્ડ એસેટ મેનેજમેન્ટ ક્વોલિફિકેશન્સ) હવે બ્રામ્પટનમાં આપવામાં આવે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો - વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત લાયકાતો આપવાની તૈયારી બતાવતા કેનેડામાં સૌ પ્રથમ અસ્ક્યામત સંચાલન તાલીમ અને નવીનશોધ કેન્દ્ર (એસેટ મેનેજમેન્ટ ટ્રેઈનિંગ એન્ડ ઈનોવેશન સેન્ટર) તરીકે, સીટી ઓફ બ્રામ્પટન નગરપાલિકાના કર્મચારીગણને વ્યાપક તાલીમ આપવા રાજી થયું છે જેથી તેઓને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ વ્યવહારો સ્વીકારવામાં અને નવી અસ્ક્યામત સંચાલન આયોજન જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળે.

જાન્યુઆરી 1, 2018 થી અમલમાં આવે તે રીતે, [ઓન્ટેરિયો રેગ્યુલેશન 588/2017: નગરપાલિકાની માળખાગત સગવડો માટે અસ્ક્યામત સંચાલન આયોજન \(મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે એસેટ મેનેજમેન્ટ પ્લાનિંગ\)](#) માટે જરૂરી બને છે કે દરેક નગરપાલિકા જુલાઈ 1, 2019 સુધીમાં વ્યૂહાત્મક અસ્ક્યામત સંચાલન કાર્યનીતિ અને જુલાઈ 1, 2024 સુધીમાં તબક્કાવાર અસ્ક્યામત સંચાલન યોજના વિકસાવે.

ગયા વર્ષે, સીટી ઓફ બ્રામ્પટને એસેટ મેનેજમેન્ટ એકેડેમી (AMA) સાથેની ભાગીદારીમાં અસ્ક્યામત સંચાલન તાલીમ અને નવીનશોધ કેન્દ્ર શરૂ કર્યું. અસ્ક્યામત સંચાલન વ્યવસાયિકો માટે વૈશ્વિક અસ્તિત્વ ધરાવનાર, ઈન્સ્ટિટ્યુશન ઓફ એસેટ મેનેજમેન્ટ (IAM) દ્વારા સમર્થિત, સીટી ઓફ બ્રામ્પટન કેનેડામાં સૌથી પહેલું તાલીમ અને પરીક્ષા સ્થળ બન્યું જેણે અસ્ક્યામત સંચાલન માટે ISO 55000 ધોરણો સાથે સુસંગત રહીને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ વ્યવહારો પર ધ્યાન કેન્દ્રિત કરતા તાલીમ અભ્યાસક્રમો આપ્યા.

ઓન્ટેરિયોની નગરપાલિકાઓ અસ્ક્યામત સંચાલન આયોજન હાથમાં લેવા કર્મચારીગણની ક્ષમતા વિકસાવે એટલે, કેન્દ્રમાં અપાતી તાલીમ અને નેટવર્કિંગ તકો તેઓનું અસ્ક્યામત સંચાલન આયોજન જ્ઞાન આધુનિક કરશે, તે જ વખતે નવી અસ્ક્યામત સંચાલન આયોજન નિયમન જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે.

તાલીમ અભ્યાસક્રમો સમગ્ર કેનેડામાં જાહેર અને ખાનગી ક્ષેત્રની એમ બંને સંસ્થાઓના એવા ઉમેદવારો માટે ખુલ્લાં રહે છે જેઓ વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત લાયકાતો મેળવવાનું શોધી રહ્યાં હોય: IAM સર્ટિફિકેટ અને IAM ડિપ્લોમા.

આગામી તાલીમ સત્રો અને અભ્યાસક્રમ વિગતો અંગેની માહિતી અહીં ઉપલબ્ધ છે: [www.brampton.ca/AMTraining](http://www.brampton.ca/AMTraining)

### અવતરણ (ક્વોટ):

“કેનેડામાં સૌથી પહેલું વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત અસ્ક્યામત સંચાલન તાલીમ અને નવીનશોધ કેન્દ્ર એક રીત માત્ર છે જેમાં સીટી ઓફ બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં હોય અને આપણાં શહેરને આગેવાન નવીનશોધ કરનાર તરીકે આગળ લાવવા પ્રયત્નશીલ હોય. અમને અસ્ક્યામત સંચાલનના વ્યવહારનું આધુનિકીકરણ કરવામાં AMA અને IAM સાથે સહયોગ કરવામાં ગૌરવ રહ્યું છે, જે દેશભરમાં તમામ નગરપાલિકાઓ માટે નિર્ણાયક હોય.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહનકારક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુસ્સામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)